

‘સન્હે મહેશ્વર’-30--01 જાન્યુઆરી, 2006

વૃદ્ધોનો આદર-એ જ યુવાપેઢીની શોભા

--વલ્લભમાઈ ઈટાલીયા

-સુરત

શરીર અને સમય બજે વજાદારીપુર્વક પોતાનો ધર્મ પાળે છે. બાલ્યાવસ્થા સમય જતાં વૃદ્ધાવસ્થાને આંબે એ કુદરતનો કાનુન છે. કોઈ કુટુંબ કેટંનું સંસ્કારી છે, એ જાગતા એ કુટુંબનાં બાળકો કેટંનું હેત અને વૃદ્ધો કેટલો આદર પામે છી તે જાણી લેવું. આપણા સમાજમાં વૃદ્ધોની કેટલી કાળજી લેવાય છે એના પર આજની યુવાપેઢીની ખાનદાની નીભર છે.

જે ઘરમાં વૃદ્ધોને અશાંતી હોય એ ઘરમાં શાંતી હોવાની સંભાવના નહીંવત હોવાની. કેટલાંક ઘરો પર “માતૃકૃપા” કે “પીતૃકૃપા” લખેલું તો હોય; પરંતુ એ ઘરનાં વૃદ્ધોને મળીએ ત્યારે ખબર પડે કે માતા અને પીતા તો સંતાપોની કૃપા ઉપર જીવી રહ્યાં છી ઘયપણમાં ગમતું નથી અને સમય કેમ કાઢવો? આવા સમયના ખાલીપાને પુરવાની સમસ્યા પાયાની બની જાય છે. આવા સમયે વૃદ્ધો પરીવારજનોનાં કેવળ સેહ અને હુંકરંખે. કેટલીક વાર તો મનગમતો ખોરાક ન મળે ત્યારે પણ વૃદ્ધોની હતારા વધી જાય છે. કેટલીક વાતો ખુબ નાની હોય; પરંતુ વૃદ્ધોની સમસ્યા ઉકેલવા પુરતી હોય છે.

બાળપણ મળ્યું એટલે માણસને ઘરપણ મળે એવી પુરી સંભાવના રહેલી છે. માણસે વૃદ્ધાવસ્થાની તૈયારી યુવાવસ્થા કે પૌઠાવસ્થાથી કરવી જોઈએ. વૃદ્ધોએ પોતાના નીવિહ પુરતી બચત પુર્વવસ્થામાં જ કરી રાખવી જોઈએ. ખાવા-પીવા, રહેવા-પહેરવાની વ્યવસ્થા થાય એટલી બચત હોય તો પોતાનો બોજો સંતાપો પર ન આવી પડે. ધ્યાનમાં રાખજો, સંતાપો તથા વૃદ્ધોનું જીવન જગતાપોર અથવા કહવું બનાવી હેનારું સૌથી પથ્યમ અને સૌથી મજબુત કારણ ‘આર્થિક બોજ’ છે. વૃદ્ધાવસ્થામાં આર્થિક વ્યવસ્થા વગર જીવનું એ ઘણીવાર બોખા મોઢે ચણા ચાવવા જેવું કઠીન બની જાય છે.

શરીરથી યુવાન લાગતો માણસ પણ મનથી માંદો અને વૃદ્ધ હોઈ શકે અને શરીરથી વૃદ્ધ થયેલો માણસ પણ મનથી યુવાન અને તંદુરસ્ત હોઈ શકે. શરીરથી ઘરએ થયેલો માણસ આંદંમાં રહી શકે; મનથી ઘરએ થયેલો નહીં. બુઢાપામાં માણસ પોતાના મન અને વૃતીઓ પર કાબુ રાખી શકે, સંયમ અને આત્મનીયંત્રણ જાળવી શકે તો સુખી થવાનું બહુ અધરું નથી. ૬૫ વર્ષ વાતાવી ચુકેલા ઘણા યુવાન વૃદ્ધોને હું-નીકટથી જાણ્ણું છું. અન્યને ઉપયોગી બની જીવન જીવવાના નીતનવા ઉમળકાથી છલકતા યુવાન વૃદ્ધો! દેહધર્મને વજાદારીપુર્વક પાળવામાં આવે તો વૃદ્ધત્વમાં પણ યુવાનીનો એહસાસ જળવાઈ રહેવો અશક્ય નથી. શારીરિક પક્ષાઘાત કરતાં માનસીક પક્ષાઘાત માણસ માટે ઓછો હાનીકર્તાની નથી હોતો.

મીત્રો, આપણો પથ્થરની પુજા ભલે કરીએ; પરંતુ આપણા ઘરના પાયાનો પથ્થર તો છે-વૃદ્ધ. ઘરજાં માલાપને તરછોડી, ઈશ્વરને પામવા મથતો માણસ, પરમાત્માને પામે એ વાતમાં માલ નથી. દરેક સાસુ-સસરા પોતાની પુત્રવધુને દીકરી સમજીને વ્યવહાર કરે અને દરેક વહુ તેનાં સાસુ-સસરાને માતા-પીતા માને તો જગતાને કેટલો અવકાશ બચે?

વણમાગી સલાહ આપ્યા કરવાની વૃદ્ધોની કુટેવને કરાશે યુવાપેઢીને જાપથી અરુચી અને અપચો થાય છે. માણસ જ્યાં સુધી કુટુંબના ઉપયોગમાં આવે છે ત્યાં સુધી જ તેના હુકમનો અમલ થાય છે; પછી વીસ્કેટ થાય છે! આપણો વાતો સામેના માણસને ક્યારે કંટાળો આપે છે એ સવાલનો જવાબ વૃદ્ધોને શોધતાં આવડી જાય, તો ઘણી સમસ્યાઓ ઉકલી જાય. વૃદ્ધોએ યુવાનો માગો તો જ અને તે બાબતે જ સલાહ આપવા જેટલી કરકસરની ટેવ પાહવા જેવી છે. કુટુંબના સભ્યોને સલાહની જરૂર પડે ત્યારે હોશેહોંશે દોરતાં ભલે આવે. એટલા વીલંબથી આપેલી સલાહ કદી કોઈને કઠે ખરી? વૃદ્ધોએ જાણી રાખવા જેવું છે કે, થોડા જ વખતમાં તેઓ તો કાયમી વીધાય લઈ જ લેવાના છે અને તે પછીય સંતાપોનું જીવન તો તેમની શક્તિ, સમજ તથા સામથ્ર અનુસાર ચાલવાનું જ છે. પછી એ બાબતે વૃદ્ધોએ જીવતાં જ અનાસક્તી કેળવવી એ હાપણભર્યો માર્ગ છે.

માણસ ઘરએ થાય એટલે માથાના વાળ રેશમ જેવા ઘોળા થઈ જાય, ચામડી સાંદીયાના હોઠની જેમ લબડી પડે, ચહેરા પર ચોળાઈ ગયેલા કાગળની જેમ કેકદેકાણો કરચલીઓ પડી જાય, દાંત મોઢામાંથી ફરવા નીકળી જાય, પગ ડગલાં માંડે ત્યાં ઘડ પડુંપડું થાય, આંખો જાગ કાચના હાબલાની આરપાર માંડ થોડું ભાળે, શરીરનાં બધાં અંગો એકપછી એક કમજોર થવા માંડે; પણ જીબ એવી માયા કે, એ ઘરપણમાં વધારે જોર પકડે! જે માણસ ઘરપણમાં પોતાની જીભને કાબુમાં રાખી શકે છે, એ ૨૦ ટકા સંજોગોને પોતાના કાબુમાં રાખી શકે છે. જે વૃદ્ધો કાયરે બોલવું, કેટલું બોલવું, શું બોલવું અને કેવી રીતે બોલવું આટલું ન જાણી રાખે, તેને દુખી થવાનો અધીકાર છે. મારો દીકરો થોડોક

સમજણો થાય એટલે કહી રાખવું છે કે, હું ઘરપણમાં બહુ ફેંકાફેંક કરું કે, મેં તો યુવાનીમાં આમ કરેલું ને તેમ કરેલું-એવી ઉંશસો મારું તો મને મારો આ વેખ એકવાર સામે જરૂર ધરજે..

(૨)

સમય મળે ત્યારે યુવાનોએ વૃદ્ધ વડીલ પાસે જઈ બેસવું અને તેમને અનુકૂળ હોય તેવી વાતો કરવી, તો વૃદ્ધને પારાવાર માનસીક પ્રસન્નતા પ્રાપ્ત થાય. વૃદ્ધો પ્રત્યે આદર, સ્નેહ અને ઉષ્માભર્યો વર્તાવ રાખવો એ યુવા પેઢીની જવાબદારી જ નહીં; ધર્મ પણ છે. શક્ય હોય ત્યાં સુધી ઘરં દાદા-દાદીનો એક રૂમ અલાયદી રહેવો જોઈએ. વૃદ્ધોને પણ નરવી અંગતતા જઈએ. અંગતતા એક અત્યંત જરૂરી અને એટલી જ પવીત્ર ચીજ છે. વૃદ્ધ દાદા-દાદી એક ઓરહીમાં સાથે ન સુઈ શકે એવા વીચારો સોણી સદીમાં શોભે; એકવીસમી સદીમાં નહીં!

પાછલી ઉમરે માણસ ઘરબંગ થાય, વીધુર કે વીધવા બને ત્યારે તેના જીવનમાં ખાલીપો વધારે વીકરાળ બની જાય છે. તોજનગ્રસ્ત દરીયામાં નાવીક વગરની નાવ ફંગોળાતી રહે તેમ, જીવનસાથી વગરની વૃદ્ધની છંદગી સંસારમાં ફંગોળાતી રહે છે. અચાનક આત્મી પેઢી એકલતા અસંખ્ય લાગવા માંદે છે. માણસે માત્ર સાથે જીવવાની જ નહીં; એકલા જીવવાની પણ માનસીક તૈયારી કરી રાખવી જોઈએ.

જીવનમાં મોટા ભાગની સમસ્યાઓનું મુળ હોય છે-અપેક્ષા. મને ગણો, મને પુછીને જ બધું કરો, મને મહત્વ આપો, મારી સાથે ચર્ચ-વીચારણા કરીને જ સંઘાં વ્યાવહારીક કાર્યો કરો-વૃદ્ધોની આવી જીદ અને અધીકારવૃત્તી કેટલીકવાર ઘરમાં જઘણનાં મુળ રોપે છે. જીવનમાંથી હુખનાં મુળીયાં ઉભેડી નાખવાં હોય તો પહેલાં અપેક્ષાનાં મુળીયાં ઉભેડી નાખવાં પડે. અપેક્ષાઓના સ્થાને સ્વજનો પ્રત્યે કેવળ નીચ્યેજ સ્નેહ અને સાચકલો પ્રેમ પગટે તો સુખી થવાનું અઘરું નથી. માણસ વધેલા નખ કાપે છે એમ, વધેલી અપેક્ષાઓને પણ કાપતા રહેલું જોઈએ!

વૃદ્ધોએ પોતાની એકલતા હુર કરવા સમાન વયસ્કોની સોબત(કંપની) બનાવી લેવી એ બહેતર માર્ગ છે. આ ભાગદોરના યુગમાં સંતાનો પાસેથી સોબત માટે સમય માગવો એ વૃદ્ધો પાસેથી ખોરાકી માગવા જેવું છે!

સમવયસ્કો સાથે દીસ્તી-સોબત વધારવા ઉપરાંત વૃદ્ધોએ મનપસંદ એવા રસો પણ કેળવી લેવા જોઈએ: ખાસ કરીને વાચન, સંગીત-ભજન, જેવા શોખ. શાકભાજી લાવવાં-ફોલવાં-છોલવાં જેવું ઘરનું અમુક હળવું કામ વડીલો કરે તો વૃદ્ધનો સમય પસાર થાય અને એને ઘરમાં પોતાની ઉપયોગીતા વરતાય. ડેસીમા તો ઘણાં ઘરકામમાં જોડાઈ શકે, પણ પ્રક્ષ ડેસાળનો છો વડીલો-વૃદ્ધો માટે ઉત્તમોત્તમ કામ તો બાળકોને રમાડવાનું હોય. માતાથી માંડીને શીક્ષક સુધીની ભૂમીકા અદા કરવી એ 'અદા' માટે અઘરી વાત નથી. લાઉકાં બાળકો અને વત્સલ-પ્રેમાળ દાદા-દાદી એ સંસારનું એક માણવા લાયક દશ્ય છે.

બુદ્ધપામાં ઘરમાં કોઈ સંભાળ ન રાખે, સ્વભાવથી સ્વજનો સાથે મેળ ન બેસે ત્યારે કેટલાક વૃદ્ધજનને ઘરબાઘરનું શરણું શોધવું પડે છે. જીવનભરના પરીક્રમથી જે ઘરનો માળો બાંધ્યો હોય એવા દીર્ઘપરીશીત ઘરને પળવારમાં તજી વૃદ્ધાશ્રમમાં જતાં વૃદ્ધોને કેટલી વેદના થતી હશે? હું વૃદ્ધ ન હોવા છતાં માત્ર કલ્યનાથી વૃદ્ધની વેદના સમજી શકું છું. દીકરી ઘર છોડે અને દીકરો તરછોડે ત્યારે હુનીયામાં કોઈ બાપનું હૈયું નીચોવાયા વીના અને આંખો ભીજાયા વીના રહી શકે? મીત્રો, રાજા હોય કે રંક, સૌથી વધારે સુખી તો એ છે, જે પોતાના ઘરમાં શાંતી મેળવી શકે.

ભારતમાં આઠક કરોડ જેટલા વૃદ્ધો હ્યાત હોવાનો અંદાજ છે. આટલી મોટી સંખ્યામાં જીવી રહેલાં વૃદ્ધો યુવાપેઢી તરફથી આદર પામતાં થાય તો દેશનો ખુબ મોટો વૃદ્ધસમાજ તેમના જીવનનું અંતીમપર્વ, ઉત્તરાવસ્થા આનંદપુર્વક ગાળી શકે. એને માટે બજે પક્ષે બાંધછોડ કરવી જરૂરી છે. બાંધછોડ વગરનો માણસ એટલે બ્રેક વગરનો ખટારો!

-વલ્લભભાઈ ઈટાલીયા

-સુરત

સુરતના દૈનીક 'લોકસમર્થન'ના તા.3 જુલાઈ 2003ના અંકમાથી સહેજસાજ ટુંકાવીને, 'ઉત્તમજોહણી' અને 'વીજ્યા-કલાપી' ફોન્ટમાં, 'સન્દે મહેશ્વિલ' તા. 1 જાન્યુઆરી 2006 માટે સાભાર પુનર્વ્યાપન : uttamgajjar@hotmail.com